

August 12, 2024

To,

BSE Limited

Phiroze Jeejeebhoy Towers,

Dalal Street, Fort,

Mumbai - 400 001

Security ID: <u>LESHAIND</u> Security Code: <u>533602</u>

Sub: Copy of Advertisement of Unaudited Financial Results for the Quarter ended on June 30, 2024.

Dear Sir/Madam,

Please find enclosed herewith copy of Advertisement of Unaudited Financial Results for the Quarter ended on June 30, 2024 as per the Regulation 47(1) (b) and 47(3) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 published in one English daily newspaper and one daily newspaper in the language of the region, where the registered office of the company is situated.

Please take the same on your record.

Thanking You,

Yours faithfully,

For Lesha Industries Limited

Leena A-Shah

Leena A. Shah Managing Director

DIN: 02629934

Encl: As above

7th Floor, Ashoka Chambers, Mithakhali Six Roads, Ahmedabad - 380 006. Phone: +91 - 79 - 26463227

Web: www.lesha.in E-mail: info@lesha.in

CIN: L27100GJ1992PLCO18607

ભારત સરકાર ૪૦૦ ચાઈનીઝ કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ્દ કરશે

ભારત અમેરિકા અને પશ્ચિમી દેશો સેગમેન્ટની જ મોટાભાગની ચીની કંપનીઓ સાથે સંકળાયેલી છે. સારા સંબંધ રાખીને તાલથી તાલ કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓ પર કડક વસુલાત, ખૂબ મિલાવી આગળ વધી રહ્યું છે તો બીજી એમસીએ દેશમાં ચાલતી આ પ્રકારની ઊંચા વ્યાજદર વસલવાનો અને તરફ દરેક ક્ષેત્રે ભારતના કટ્ટર લોન એપ્લિકેશનની છેલ્લા કેટલાક પ્રતિધ્વંધિ ચીનને લપડાક આપવા પણ વર્ષોથી સઘન તપાસ કરી રહ્યું છે. આ કટિબદ્ધ છે. ભારત સરકાર ચીન પર એપ થકી લોન આપવા અયોગ્ય વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકની તૈયારી માધ્યમોનો ઉપયોગ થઈ રહ્યો છે અને કરી રહ્યું છે. અહેવાલ અનુસાર નાણાંકીય નિયમોનું ઉલ્લંઘન કરીને ભારત ૩ મહિનામાં ૪૦૦ ચીની જનતા સાથે છેતરપિંડી થઈ રહી કંપનીઓની માન્યતા રદ્દ કરી શકે છે. હોવાની અનેક ફરિયાદો મળી છે. થાય છે. કંપની એક્ટની કલમ ૨૪૮

કેન્દ્ર સરકારના નેજા હેઠળનું મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ આગામી ત્રણ માસમાં દેશના ૧૭ રાજ્યોમાં રજિસ્ટર્ડ ૪૦૦ ચાઇનીઝ કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ્દ કરી શકે છે. નાણાકીય ગોટાળા-ધાંધલબાજી અને અન્ય કેટલાક કારણોસર મંત્રાલય આ કાર્યવાહી કરી શકે છે.

એક સરકારી અધિકારીએ જણાવ્યું કે. કોર્પોરેટ અફર્સ વિભાગ ૭૦૦ કંપનીઓની તપાસ કરી રહ્યું છે. તેમાંથી ૬૦૦ ચાઈનીઝ કંપનીઓની તપાસ પર્શ થઈ ગઈ છે અને તેમાંની ૩૦૦-૪૦૦ કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ્દ કરવામાં આવશે. ખંભાતી તાળાની કગાર પર

શિક્ષકોને પ વર્ષનો અનુભવ હોય તો અરજી કરી શકાશે

ગાંધીનગર,

રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગના દ્વારા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત હવે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો ૧:૩નો રહેશે. શિક્ષણ વિભાગ હસ્તકની ગ્રાન્ટેડ શાળામાં(લઘુમતી સિવાય) ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જના શિક્ષક તરીકે અરજી કરી શકશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા પોર્ટલ દ્વારા ઓનલાઈન કરવામાં આવશે.

શિક્ષણ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર આ ઠરાવની તારીખે વયનિવૃત્તિ માટે બે વર્ષ કરતાં ઓછો સમય બાકી હોય તેવા શિક્ષક અરજી કરી શકશે નહીં. જૂના શિક્ષક તરીકે ભરતી માટે સમગ્ર સેવાકાળ દરમિયાન માત્ર એક જ વખત લાભ મળવાપાત્ર થશે અને જુના શિક્ષક તરીકે નિમણક મળતાં તે શિક્ષકની સેવા સળંગ ગણાશે. ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ સહાયક તરીકે કરેલ ફિક્સ પગારની નોકરીનો અનુભવ ગ્રાહ્ય રહેશે અને જૂના શિક્ષક તરીકે ભરતીની લાયકાત ઉમેદવારના શૈક્ષણિક અનુભવને આધારે મેરીટ તૈયાર કરવામાં આવશે. રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે શિક્ષણ વિભાગના ઠરાવમાં ૧:૩ના રેશિયાથી શિક્ષકોની ભરતી કરવાની જોગવાઇ હતી. જુના શિક્ષકની આ ભરતી વર્ષ ૨૦૧૧માં થઇ હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૬ની ભરતીમાં શિક્ષક તરીકેનો ફિક્સ પગારનો સમયગાળો ગણવો કે નહિ તે પ્રશ્નનું નિરાકારણ લાવવામાં આવ્યં છે. જેમાં વતનથી દુર નોકરી કરતા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકને વતનનો તથા કુટુંબ સાથે રહેવાનો લાભ મળે અને સામાજિક જીવન અસ્ત-વ્યસ્ત થત્ અટકે તેનો સરાહનીય નિર્ણય કરાયો

રાજ્યની ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કુલમાં જુના શિક્ષકોની ભરતી એટલે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ૧૦૦ જગ્યાઓ છે એમાંથી ૭૫ જે મેરિટમાંથી જ ભરાશે અને બાકીની ૨૫ જગ્યા જે ઓલરેડી ગ્રાન્ટેડ શાળામાં શિક્ષક છે એ લોકોની આમાંથી ભરતી થાય.

માની લો કે, જો કોઈ ખેડા જિલ્લાનો ઉમેદવાર કચ્છમાં નોકરી કરતો હોય તો હવે ખેડા જિલ્લામાં ગ્રાન્ટેડ શાળામાં જના શિક્ષકની જગ્યા હોય તો એને પછી વતનમાં આવવાની તક મળે, એના અમુક ધારાધોરણ હોય કે, પ વર્ષની નોકરી હોવી જોઇએ અને નિવૃત્તિના સમય આડે ૨ વર્ષ કરતા વધુ સમય હોય તો જ અરજી કરી શકે. તેમજ ગણિત-વિજ્ઞાનના શિક્ષકની જગ્યા ખાલી હોય અને તે ગણિત વિજ્ઞાનના શિક્ષક હોય તો જ તેની નિયુક્તિ થઈ શકે.

વૈશ્વિક મહાસત્તા બનવા માટે ઓનલાઈન જોબ વગેરે જેવા છે અને તેમાંની મોટાભાગની એપ અનૈતિક પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. આ સિવાય ભારતમાંથી ગેરકાયદેસર ફંડ અન્ય દેશોમાં ટાન્સફર કરવાનો પણ આરોપ છે. અનેક કંપનીઓમાં ભારતીય ડાયરેક્ટર છે, જ્યારે બેક્ર એકાઉન્ટ ચીનથી ઓપરેટ તાજેતરના વર્ષોમાં ડિજિટલ લોન હેઠળ બિઝનેસ બંધ કરવાની પ્રક્રિયામાં એપ્સની વધતી સંખ્યા આરબીઆઈ ૩ મહિનાનો સમય લાગે છે.

સુધારો

PICICI Bank બાંચ ઓફિસ : આઈસીઆઈસીઆઈ બેંક લિ., ઓફીસ નં.૨૦૧-બી, બીજો માળ, રોડ નં. ૧, પ્લોટ નં.બી ૩, વાઈફાઈ આઈટી પાર્ક, વાગલે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, થાણે , મહારાષ્ટ્રા-૪૦૦૬૦૪.

આ આઈસીઆઈસીઆઈ બેંક લિ.સાથેના દેવાદાર નામે જયશુખભાઈ દેવજીભાઈ ગજિપારા જેમનો હોમ લોન ખાતા નં. QZSUR00005035393 સંદર્ભે ૨૭મી ઓગષ્ટ, ૨૦૨૦ની તારીખવાળી નોટિસ(અહી ત્યારબાદ ઉક્ત નોટિસ તરીકે સંદર્ભ લેશો) સરફેસી -૧૩(૨) હેઠળ નોટિસના અનસંધાનમાં છે. અમે અહીં જાણ કરવા માંગીએ છીએ કે અજાણતા મિલકતના સરનામામાં તથા એરિયા માપણીમાં ભૂલથી પ્લોટ નં.૮૮, શિવ રામેશ્વર રેસિડેન્સી, પ્રાથમિક સ્કૂલ પાછળ અને શિવાંજિલ રેસિડેન્સી , મોજે-મનકના, કામરેજ, સુરત, સુરત, ગુજરાત-૩૯૫૦૧૦(વેચાણખત મુજબ માપણી એરિયા) તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી આપને વિનંતી છે કે તમે તેને નીચે આપેલા પ્લોટ નં.૮૮ બ્લોક નં.૨૧૮/બી,(રિસર્વે બાદ નવા બ્લોક નં.૨૬૨), શિવ રામેશ્વર રેસિડેન્સી, પ્રાથમિક સ્કૂલ અને શિવાંજલિ રેસિડેન્સી પાછળ, મોજે-મનકના, કામરેજ, સુરત, ગુજરાત-૩૯૫૦૧૦ માપણી પ્લોટ એરિયા ૪૭.૯૩ સ્કે.મી. (લોકેશન મુજબ), ૪૯.૦૮ સ્કે.મી. (મંજુર થયેલ પ્લાન મુજબ), સાથે રોડ અને સીઓપીમાંના અવિભાજીત પ્રમાણસરન્ માગ માપણી ૩૩.૫૮ સ્કે.મી. તરીકે વાંચવી.

સરફ્રેસી-૧૩(૨) નોટિસમાંની અન્ય તમામ વિગતો સમાન રહેશે. આ સંબંધમાં આપને થયેલી અસુવિધા બદલ અમે દિલથી દિલગીર છીએ

તારીખ : ઓગષ્ટ ૦૯, ૨૦૨૪ સ્થળ : સુરત

અધિકત અધિકારી આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ

સુધારો

PICICI Bank

બ્રાંચ ઓફિસ : આઈસીઆઈસીઆઈ બેંક લિ., ઓફીસ નં. ૨૦૧-બી, બીજો માળ, રોડ નં. ૧, પ્લોટ નં.બી ૩, વાઈફાઈ આઈટી પાર્ક, વાગલે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, થાણે, મહારાષ્ટ્ર -૪૦૦૬૦૪.

આ આઈસીઆઈસીઆઈ બેંક લિ.સાથેના દેવાદાર નામે અમિતભાઈ અશ્વિનભાઈ ચુડાસમા જેમનો હોમ લોન ખાત નં. QZSUR00005035926 સંદર્ભે ૦૯મી જુન, ૨૦૨૧ની તારીખવાળી નોટિસ(અહી ત્યારબાદ ઉક્ત નોટિસ તરીકે સંદર્ભ લેશો) સરફેસી ૧૩(૨) હેઠળ નોટિસના અનુસંધાનમાં છે.

અમે અહીં જાણ કરવા માંગીએ છીએ કે અજાણતામાં મિલકત સરનામામાં તથા એરિયા માપણીમાં ભૂલથી પ્લોટ નં.૧૧૦, સાજન હોમ્સ, નાનસદ તળાવ પાસે, મોજે-નાનસદ, કામરેજ, ગુજરાત સુરત-૩૯૪૨૧૦ (વેચાણખત મુજબ માપણી એરિયા) તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી આપને વિનંતી છે કે તમે તેને નીચે આપેલા પ્લોટ નં.૧૧૦ (કે.જે.પી.મુજબ સુધારેલ બ્લોક નં.૧૩૦/૨/૧૧૦), રેવન્યુ સર્વે નં.૧૦૨, જુના બ્લોક નં.૧૧૬,(રિ-સર્વે નવા બ્લોક નં.૧૩૦), સબપ્લોટ નં.-૨, સાજન હોમ્સ, નાનસદ તળાવ પાસે, મોજે-નાનસદ, કામરેજ, ગુજરાત સુરત ૩૯૪૨૧૦ માપણી પ્લોટ એરિયા ૪૦.૧૯ સ્કે.મી., સાથે રોડ અને સીઓપીમાંના અવિભાજીત પ્રમાણસરના ભાગ માપણી ૨૯.૧૦ સ્કે.મી. કુલ માપણી ૬૯.૨૯ સ્કે.મી. એવું વાંચવું .

સરફેસી ૧૩(૨) નોટિસમાંની અન્ય તમામ વિગતો સમાન રહેશે. આ સંબંધમાં આપને થયેલી અસુવિધા બદલ અમે દિલથી દિલગીર છીએ.

તારીખ : ઓગષ્ટ ૦૯, ૨૦૨૪ સ્થળ : સુરત

અધિકૃત અધિકારી આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ

સુધારો

#ICICI Bank

બ્રાંચ ઓફિસ : આઈસીઆઈસીઆઈ બેંક લિ., ઓફીસ નં. ૨૦૧-બી, બીજો માળ, રોડ નં.૧, પ્લોટ નં.બી ૩, વાઈફાઈ આઈટી પાર્ક, વાગલે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, થાણે (વેસ્ટ)-૪૦૦૬૦૪.

આ આઈસીઆઈસીઆઈ બેંક લિ.સાથેના દેવાદાર નામે કામદેઓ પ્રસાદ વર્મા જેમનો હોમ્ લોન ખાતા નં. QZSUR00005036243 સંદર્ભે ૧૮મી જુન, ૨૦૨૧ની તારીખવાળી નોટિસ(અહી ત્યારબાદ ઉક્ત નોટિસ તરીકે સંદર્ભ લેશો) સરફેસી ૧૩(૨) હેઠળ નોટિસના અનુસંધાનમાં છે. અમે અહીં જાણ કરવા માંગીએ છીએ કે અજાણતા મિલકતના સરનામામાં તથા એરિયા માપણીમાં ભૂલથી પ્લોટ નં.૪૬, સારથી ટાઉનશીપ, પેસિફિક એન્જી.કોલેજ પાસે, મોજે-ટાંટીથૈયા, સુરત-ગુજરાત સુરત-૨૨૦૩૦૯(વેચાણખત મુજબ માપણી એરિયા) તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી આપને વિનંતી છે કે તમે તેને નીચે આપેલા પ્લોટ નં. ૪૬, બ્લોક નં. ૨૭૮/બી/૪૬, રેવન્યુ રેકોર્ડ મુજબ્ સારથી ટાઉનશીપ, પેસિફિક એન્જી.કોલેજ પાસે, મોજે-ટાંટીથૈયા, સુરત-ગુજરાત, સુરત-૨૨૦૩૦૯ માપણી પ્લોટ એરિયા ૪૪.૫૯ સ્કે.મી. અથવા ૫૩.૩૩ સ્કે.યાર્ડેસ તરીકે વાંચર્વુ. સરફર્સી ૧૩(૨) નોટિસમાંની અન્ય તમામ વિગતો સમાન રહેશે

આ સંબંધમાં આપને થયેલી અસુવિધા બદલ અમે દિલથી દિલગીર છીએ.

તારીખ : ઓગષ્ટ ૦૯, ૨૦૨૪ સ્થળ : સુરત

અધિકૃત અધિકારી આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ

સુધારો

માં કો માં કે પ્રાર્થી આઈ લોક લિ., ઓફીસ નં. ૨૦૧-બી, બીજે માળ, રોડ નં. ૧, પ્લોટ નં.બી.૩, વાઈફાઈ આઈટી પાર્ક, વાગલે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, થાણે, મહારાષ્ટ્રા -૪૦૦૬૦૪.

આ આઈસીઆઈસીઆઈ બેંક લિ.સાથેના દેવાદાર નામે વના ભાઈ રતનશીભાઈ પટેલ જેમનો હોમ લોન ખાતા નં. QZSUR00005011425 સંદર્ભે ૧૯મી જુન, ૨૦૨૧ની તારીખવાળી નોટિસ(અહી ત્યારબાદ ઉક્ત નોટિસ તરીકે સંદર્ભ લેશો) સરફેસી ૧૩(૨) હેઠળ નોટિસના અનુસંધાનમાં છે. અમે એહીં જાણ કરવા માંગીએ છીએ કે અજાણતા મિલકતના સરનામામાં તથા એરિયા માપણીમાં ભૂલથી ફ્લેટ નં.આઈ/૮૦૩ સિલિકોન પાલ્મ, સાઈ વીલા રેસિડેન્સી પાસે, મોજે-ડિંડોલી, ગુજરાત સુરત-૩૯૪૨૧૦(વેચાણખત મુજબ માપણી એરિયા) તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી આપને વિનંતી છે કે તમે તેને નીચે આપેલા ફ્લેટ નં.આઈ/૮૦૩, બિલ્ડિગં નં.આઈ, આઠમો માળ, સિલિકોન પાલ્મ, સાંઈ વીલા રેસિડેન્સી પાસે મોજે-ડિંડોલી, આર.એસ.નં.૧૫૫/૧૩, બ્લોક નં.૨૨ં૩, ટીપીએસ નં.૬૨, ઓરિજનલ પ્લોટ નં.૨૭ અને એફ.પી.નં.૨૭, ગુજરાત, સુરત-૩૯૪૨૧૦ માપણી એરિયા બિલ્ટઅપ એરિયા ૪૭.૫૮ સ્કે.મી. સુપર બિલ્ટઅપ એરિયા ૬૬.૦૭ સ્કે.મી. તરીકે વાંચવું.

સરફેસી ૧૩(૨) નોટિસમાંની અન્ય તમામ વિગતો સમાન રહેશે. ખા સંબંધમાં આપને થયેલી અસુવિધા બદલ અમે દિલથી દિલગીર છીએ.

તારીખ : ઓગષ્ટ ૦૯, ૨૦૨૪ સ્થળ : સુરત

અધિકૃત અધિકારી આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ

સુધારો

ficici Bank

બ્રાંચ ઓફિસ : આઈસીઆઈસીઆઈ બેંક લિ., ઓફીસ નં.૨૦૧-બી, બીજે માળ, રોડ નં.૧, પ્લોટ નં.બી૩, વાઈફાઈ આઈટી પાર્ક, વાગલે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, થાણે (વેસ્ટ) -૪૦૦૬૦૪.

આ આઈસીઆઈસીઆઈ બેંક લિ.સાથેના દેવાદાર નામે દિનેશ ધિરૂભાઈ રાઠોડ જેમનો હોમ લોન ખાતા નં QZSUR00005036265 સંદર્ભે ૦૩મી જુન, ૨૦૨૧ની તારીખવાળી નોટિસ(અહી ત્યારબાદ ઉક્ત નોટિસ તરીકે સંદર્ભ લેશો) સરફેસી- ૧૩(૨) હેઠળ નોટિસના અનુસંધાનમાં છે.

અમે અહીં જાણ કરવા માંગીએ છીએ કે અજાણતા મિલકતના સરનામામાં તથા એરિયા માપણીમાં ભૂલથી પ્લોટ નં.૭૬ શ્રી સિદ્ધી વિનાયક રેસિડેન્સી, શિવ રેસિડેન્સી સામે, મોજે-મણકાના, કામરેજ, ગુજરાત, સુરત-૩૯૪૨૧૦ (વેચાણખત મુજબ માપણી એરિયા) તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી આપને વિનંતી છે કે તમે તેને નીચે આપેલા પ્લોટ નં.૭૬ ુ આર.એસ. નં.૯૬, જુના બ્લોક નં.૮૮, રિ-સર્વે બાદ નવા બ્લોક નં.૭૧, પ્લોટ ટાઇપ-સી, શ્રી સિદ્ધી વિનાયક રેસિડેન્સી, શિવ રેસિડેન્સી સામે, મોજે-મણકાના, કામરેજ, ગુજરાત સુરત-૩૯૪૨૧૦ માપણી પ્લોટ એરિયા ૪૭.૫૮ સ્કે.મી.(૭/૧૨ મુજબ), રોડ અને સીઓપીમાંના અવિભાજીત પ્રમાણસરના ભાગ માપણી ૨૪.૨૮ સ્કે.મી.

સરફેસી ૧૩(૨) નોટિસમાંની અન્ય તમામ વિગતો સમાન રહેશે. આ સંબંધમાં આપને થયેલી અસુવિધા બદલ અમે દિલથી દિલગીર છીએ.

તારીખ : ઓગષ્ટ ૦૯, ૨૦૨૪ સ્થળ : સુરત

અધિકૃત અધિકારી આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ

સુધારો

#ICICI Bank

બ્રાંચ ઓફિસ∶આઈસીઆઈસીઆઈ બેંક લિ., ઓફીસ નં.૨૦૧-બી, બીજો માળ. રોડ નં. ૧, પ્લોટ નં.બી ૩, વાઈફાઈ આઈટી પાર્ક, વાગલે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, થાણે (વેસ્ટ)-૪૦૦૬૦૪.

આ આઈસીઆઈસીઆઈ બેંક લિ.સાથેના દેવાદાર નામે અતુલભાઈ દશરથભાઈ શાહ જેમનો હોમ લોન ખાતા નં LBAND00000350288 સંદર્ભે ૨૧મી જુલાઈ, ૨૦૨૩ની તારીખવાળી નોટિસ(અહી ત્યારબાદ ઉક્ત નોટિસ તરીકે સંદર્ભ લેશો) સરફેસી એક્ટ ૧૩(૨) હેઠળ નોટિસના અનુસંધાનમાં છે. અમે અહીં જાણ કરવા માંગીએ છીએ કે અજાણતાં મિલકતના સરનામામાં ભૂલથી પ્લોટ નં.૯/બી, જલવાટિકા, પુરોહિત ડાઇનિંગ હોલ પાસે, રાજ સિનેમા પાસે, વી.વી.નગર, આર.એસ.નં.૧૭૩, આણંદ-૩૮૮૧૨૦ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી આપને વિનંતી છે કે તમે તેને નીચે આપેલા પ્લોટ નં.૯/બી, જલવાટિકા, પુરોહિત ડાઇનિંગ હોલ પાસે, રાજ સિનેમા પાસે વી.વી.નગર, રેવેન્યુ સર્વે નં.૧૭૩/૨એ-૨કે, આણંદ-૩૮૮૧૨૦ તરીકે વાંચો. સરફેસી એક્ટ ૧૩(૨) નોટિસમાંની અન્ય તમામ વિગતો સમાન રહેશે. આ સંબંધમાં આપને થયેલી અસુવિધા બદ

અમે દિલથી દિલગીર છીએ. તારીખ : ઓગષ્ટ ૦૯. ૨૦૨૪ સ્થળ : આણંદ

અધિકૃત અધિકારી આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ

તાપસી પજ્ઞુએ એક પછી એક ૧૧ ફિલ્મો કરવાનું ક્યારેય વિચાર્યુ ન હતું

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ રેકોર્ડને મેચ કરી શકે, તે છે તાપસી પજ્ઞ. ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે. 'ફિર આયી હસીન દિલરૂબા' તેની પહેલાં અનુભવ સિંહાની 'થપ્પડ' તેની એક્ટ્રેસ હોય, જે પેન્ડેમિક પછી સૌથી વધુ એ બોલિવૂડની એક માત્ર એવી એક્ટ્રેસ તાપસીએ હમણા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, ૧૦મી રિલીઝ છે. જયારે ૨૦૨૦માં છેલ્લી ફિલ્મ હતી. ત્યાર પછી તેની ૧૪ ફિલ્મ રિલીઝના અક્ષય કુમારના છે જેની ઓગસ્ટમાં જ આ વર્ષની ૧૧મી 'તેણે આવું કશું વિચાર્યુનહોતું.' ૨૦૨૧થી કોરોનાના કારણે લોકડાઉન આવ્યું એ ફિલ્મોની લાઈન લાગી છે.

સુધારો

ficici Bank બ્રાંચ ઓફિસ : આઈસીઆઈસીઆઈ બેંક લિ., ઓફીસ નં. ૨૦૧-બી, બીજો માળ, રોડ નં.૧, પ્લોટ નં.બી.ર, વાઈફાઈ આઈટી પાર્ક, વાગલે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, થાણે (વેસ્ટ)-૪૦૦૬૦૪.

<mark>ખા આઈસીઆઈસીઆઈ બેંક લિ.સાથેના દેવાદાર નામ દેવિન્દ્ર એસ. આદેશરા જેમનો હોમ લોન</mark> ખાતા નં. LBRAJ00003157944 સંદર્ભે ૨૫મી ઓક્ટોબર, ૨૦૨૩ની તારીખવાળી નોટિસ(અહી ત્યારબાદ ઉક્ત નોટિસ તરીકે સંદર્ભ લેશો) સરફેસી એક્ટ ૧૩(૨) હેઠળ નોટિસના અનુસંધાનમાં છે. અમે અહીં જાણ કરવા માંગીએ છીએ કે અજાણતા એરિયા માપણીમાં ભૂલથી બિલ્ટઅપ એરિયા માપણી ૬૩૫.૦૦ સ્કે.ફીટ એટલેકે ૫૮.૯૯ સ્કે.મી. તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી આપને વિનંતી છે કે તમે તેને નીચે આપેલ સુપર બિલ્ટઅપ એરિયા માપણી ૬ ૩૫.૦૦ સ્કે.ફીટ એટલેકે ૫૮.૯૯ સ્કે.મી. તરીકે વાંચો.

એસએઆરએફએઈએસઆઈ ૧૩(૨) નોટિસમાંની અન્ય તમામ વિગતો સમાન રહેશે. આ સંબંધમાં આપને થયેલી અસુવિધા બદલ અમે દિલથી દિલગીર છીએ.

તારીખ : ઓગષ્ટ ૦૯, ૨૦૨૪ સ્થળ : રાજકોટ

અધિકૃત અધિકારી આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ

સુધારો

બાંટાCI Bank બ્રાંચ ઓફિસ : આઈસીઆઈસીઆઈ બેંક લિ., ઓફીસ નં. ૨૦૧-બી, બીજો માળ, રોડ નં.૧, પ્લોટ નં.બી.૩, વાઈફાઈ આઈટી પાર્ક, વાગલે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, થાણે, મહારાષ્ટ્રા -૪૦૦૬૦૪.

ા આઈસીઆઈસીઆઈ બેંક લિ.સાથેના દેવાદાર નામે રાવેશ્યામ મહેન્દ્ર સિંઘ જેમનો હોમ લોન ખાતા નં QZSUR00005035096 સંદર્ભે ૧૮મી જુન, ૨૦૨૧ની તારીખવાળી નોટિસ(અહી ત્યારબાદ ઉક્ત નોટિસ તરીકે સંદર્ભ લેશો) સરફેસી- ૧૩(૨) હેઠળ નોટિસના અનુસંધાનમાં છે. અમે અહીં જાણ કરવા માંગીએ છીએ કે અજાણતા મિલકતના સરનામામાં તથા એરિયા માપણીમાં ભૂલથી પ્લોટ

નં. ૬૭૬, ગોકુલધામ રેસિડેન્સી, ટાંટીથૈયા રેલ્વે ક્રોસિંગ પાસે, મોજે-ટાંટીથૈયા, પલસાણા, સુરત-ગુજરાત, સુરત-ર ૨૦૩૦૯ (વેંચાણખત મુજબ માપણી એરિયા) તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી આપને વિનંતી છે કે તમે તેને નીચે આપેલા પ્લોટ નં.૬૭૬ (મંજુર પ્લાન મુજબ પ્લોટ નં.૨૪૬), બ્લોક નં.૨૮૬/કે, આર.એસ.નં.૩૬૦/૧એ, ૩૬૦/ ર, ૩૪૩/૧, ગોકુલધામ રેસિડેન્સી, ટાંટીથૈયા રેલ્વે ક્રોસિંગ પાસે, મોજે-ટાંટીથૈયા, જી.પલસાણા, સુરત-ગુજરાત, મુરત-૨૨૦૩૦૯ માપણી એરિયા કે.જે.પી.મુજબ ૪૦.૧૮ સ્કે.મી., સાઇટ મુજબ માપણી એરિયા ૪૦.૧૩ સ્કે.મી. બેટલેકે ૪૮.૦૦ સ્કે.યાર્ડસ, સાથે રોડ અને સીઓપીમાંના અવિભાજીત પ્રમાણસરના ભાગ માપણી ૨૪.૯૭ સ્કે.મી. તરીકે વાંચવું

સરફેસી ૧૩(૨) નોટિસમાંની અન્ય તમામ વિગતો સમાન રહેશે **ખા સંબંધમાં આપને થયેલી અસુવિધા બદલ અમે** દિલથી દિલગીર છીએ

અધિકૃત અધિકારી તારીખ : ઓગષ્ટ ૦૯, ૨૦૨૪

આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ સ્થળ : સુરત

સુધારો

FICICI Bank બાંચ ઓફિસ: આઈસીઆઈસીઆઈ બેંક લિ., ઓફીસ નં.૨૦૧-બી, બીજો માળ, રોડ નં.૧, પ્લોટ નં.બી.૩, વાઈફાઈ આઈટી પાર્ક, વાગલે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, થાણે, મહારાષ્ટ્રા -૪૦૦૬૦૪.

ના આઈસીઆઈસીઆઈ બેંક લિ.સાથેના દેવાદાર નામે આશુતોષ બંસિધર પાંડે જેમનો હોમ લોન ખાતા નં QZSUR00005034935 સંદર્ભે ૧૯મી જુન, ૨૦૨૧ની તારીખવાળી નોટિસ(અહી ત્યારબાદ ઉક્ત નોટિસ તરીકે સંદર્ભ લેશો) સરફેસી ૧૩(૨) હેઠળ નોટિંસના અનુસંધાનમાં છે.

અમે અહીં જાણ કરવા માંગીએ છીએ કે અજાણતા મિલકતના સરનામામાં તથા એરિયા માપણીમાં ભૂલથી પ્લોટ નં.૩૩૩, શિવસાગર રેસિડેન્સી-૨, સર્વોતમ હોટલ પાસે, દાસ્તાન ૩૩૩, મોજે-દાસ્તાન, સુરત-૨૨૦૩૦૯ (વેચાણખત મુજબ માપણી એરિયા) તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી આપને વિનંતી છે કે તમે તેને નીચે આપેલા પ્લોટ . ાં.૩૩૩, આર.એસ. નં.૧૪૪, બ્લોક નં.૧૩૯, શિવસાગર રેસિડેન્સી-૨, સર્વોતમ હોટલ પાસે, દાસ્તાન ૩૩૩, મોજે-દાસ્તાન. સુરત-૨૨૦૩૦૯ માપણી પ્લોટ એરિયા ૬૦.૨૮ સ્કે.મી.(મંજુર પ્લાન મુજબ), ૬૦.૨૦ સ્કે.મી. (બુકિંગ પ્લાન મુજબ), સાથે રોડ અને સીઓપીમાંના અવિભાજીત પ્રમાણસરના ભાગ માપણી ૨૪.૪૨ સ્ક્રે.મી. અને ૧૧.૩૯ સ્કે.મી. કુલ માપણી ૯૬.૧૦ સ્કે.મી. તરીકે વાંચવું.

સરફ્રેસી ૧૩(૨) નોટિસમાંની અન્ય તમામ વિગતો સમાન રહેશે. આ સંબંધમાં આપને થયેલી અસુવિધા બદલ અમે દિલથી દિલગીર છીએ

તારીખ : ઓગષ્ટ ૦૯, ૨૦૨૪ સ્થળ : સુરત

અધિકૃત અધિકારી આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ

સુધારો

િ ICICI Bank બાંચ ઓફિસ : આઈસીઆઈસીઆઈ બેંક લિ., ઓફીસ નં. ૨૦૧-બી, બીજો માળ, રોડ નં.૧, પ્લોટ નં.બી૩, વાઈફાઈ આઈટી પાર્ક, વાગલે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, થાણે (વેસ્ટ)-૪૦૦૬૦૪. માં આઈસીઆઈસીઆઈ બેંક લિ સાથેના દેવાદાર નામે દક્ષેશભાઈ એમ. સરધારા જેમનો હોમ લોન ખાતા ન LBSUR00002401267 સંદર્ભે ૩૦ નવેમ્બર, ૨૦૧૯ની તારીખવાળી નોટિસ(અહી ત્યારબાદ ઉક્ત નોટિસ

તરીકે સંદર્ભ લેશો) સરફેસી એક્ટ ૧૩(૨) હેઠળ નોટિસના અનુસંધાનમાં છે. અમે અહીં જાણ કરવા માંગીએ છીએ કું અજાણતા એરિયા માપણીમાં ભૂલથી બિલ્ટઅપ એરિયા માપણી ૩૪.૦૦ સ્ક્રે.મી. કારર્પેટ એરિયા ૨૦.૪૦ સ્ક્રે.મી. ૪મીનમાંના અવિભાજીત પ્રમાણસરના ભાગ ૧૧.૪૪ સ્કે.મી. સહીત તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી આપને વેનંતી છે કે તમે તેને નીચે આપેલા સુપર બિલ્ટઅપ એરિયા માપણી ૩૪.૦૦ સ્કે.મી. કારર્પેટ એરિયા ૨૦.૪૦ .કે.મી.જમીનમાંના અવિભાજીત પ્રમાણસરના ભાગ ૧૧.૪૪ સ્કે.મી. સહીત તરીકે વાંચવું. સરફેસી એક્ટ ૧૩(૨) નોટિસમાંની અન્ય તમામ વિગતો સમાન રહેશે. આ સંબંધમાં આપને થયેલી અસુવિધા બદલ નમે દિલથી દિલગીર છીએ.

તારીખ: ઓગષ્ટ ૦૯. ૨૦૨૪ સ્થળ : સુરત

અધિકૃત અધિકારી આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ

શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ લીમીટેડ રજીસ્ટર્ડ ઓફિસ: ઓફિસ નં.૧૨૩, અન્ગપ્પા નૈકેન સ્ટ્રીટ, ચેન્નાઈ - ૬૦૦ ૦૦૧. હેડ ઓફિસ: લેવલ-૧, વોક્હાર્ડટ ટાવર્સ, ઇસ્ટ વિંગ, સી-૨, જી બ્લોક, બાન્દ્રા-કુલાં SHRIRMM

વેબસાઇટ:www.shriramhousing.in

HOUSING FINANCE કોમ્પલેક્ષ, મુંબઈ ૪૦૦ ૦૫૧

આવે છે.

સાંકેતિક કબ્જા નોટીસ આથી અહીં જણાવવાનું કે નીચે સહી કરનાર શ્રીરામ હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ (એસએચએફએલ)ના અધિકૃત અધિકારીએ સિક્યોરીટાઇઝેશન અને રિકન્સ્ટુક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ (જણાવેલ કાયદા) નિયમો, ૨૦૦૨ (જણાવેલ નિયમો)ના નિયમ ૩ સાથે વંચાતી કલમ૧ ૩(૧૨) હેઠળ મળેલી સત્તાની રૂએ નીચે કોષ્ટકમાં જણાવેલ દેવાદારોને જણાવેલ માંગણા નોટીસોમાં જણાવેલ રકમ પરત ચુકવવા માંગણા નોટીસો જારી કરી

દેવાદારો રકમની પુનઃચુકવણી કરવામાં નિષ્ફળ ગયા છે. પરિણામે દેવાદારો અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે અહી નીચે સહી કરનારે જણાવેલ કાયદાના સેકશન ૮ અને કાયદાની પેટા કલમ ૧૩(૪)ની જોગવાઈઓ મજબ ૦૭-૦૮-૨૦૨૪ ના રોજ કાર્યવાહી કરી નીચે વર્શન કરવામાં આવેલ તેના/તેશી નામે રહેલ મિલ્કતનો સાંકેતિક કબ્જો મેળવી લીધો છે.

કરજદાર અને ખાસ કરી જાહેર જનતાને મિલકત સાથે કોઈ સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે. અને મિલકત સાથેનો કોઈપણ સોદો શ્રી રામ હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડની નીચે જણાવેલ ૨કમ તેમજ તેના પર વ્યાજના ચાર્જને આધિન રહેશે. કરજદારો ધ્યાન આપે કે આ કાયદાની કલમ ૧૩ ની પેટા કલમ (૮) મુજબ આ ગીરો

મિલકત મુકત કરાવવાનો સમય મળે છે. તે માટે કરજદારોને આમંત્રીત કરવામાં દેવાદારનું નામ અને સરનામું

ા.કોટાડિયા નંદલાલ મુલજીભાઈ વર્તમાન સરનામું : ચોરા વાળી શેરી, પટેલ વાડા, તલાલા, ગિરસોમનાથ-૩૬૨૫૧૦

ખાપણ : કોટાડિયા નંદલાલ મુલજીભાઈ મિલકત સરનામું : શોપ નં.૧ પશ્ચિમ તરફથી, હરેકૃષ્ણા પ્રોવિઝન સ્ટોર, ગ્રાઉન્ડ ફ્લોર, લોહાણા સમાજ વાડી પાસે, ઓફ સ્ટેશન રોડ, તલાલા, ગિરસોમનાથ-૩૬ ૨૫૧૦

ર. કોટાડિયા શિલ્પાબેન નંદલાલ વર્તમાન સરનામું : ચોરા વાળી શેરી, પટેલ વાડા, તલાલા, ગિરસોમનાથ-૩૬૨૫૧૦ આપણઃ કોટાડિયા શિલ્પાબેન નંદલાલ

મિલકત સરનામું ૧ : શોપ નં.૧ પશ્ચિમ તરફથી, હરેકૃષ્ણા પ્રોવિઝન સ્ટોર, ગ્રાઉન્ડ ફ્લોર, લોહાણા સમાજ વાડી પાસે, ઓફ સ્ટેશન રોડ, તલાલા, ગિરસોમનાથ-૩૬ ૨૫૧૦

માંગણા નોટિસ મુજબ બાકી લેણાં રકમ

૦૭/૦૫/૨૦૨૪ ના રોજ લોન ખાતા નંબર ના સંદર્ભમાં : SLPHVRVL0000201 ૨૪,૨૫,૮૫૮/- (રૂપિયા ચોવિસ લાખ, પચ્ચીસ હજાર, આઠસોને અઠાવન પુરા) કરાર મુજબ આગળના વ્યાજ, ખર્ચા અને કોસ્ટ સાથે જણાવેલ નોટિસ મલ્યાના ૬૦ દિવસની અંદર ૧૩(૨) નોટીસ તારીખઃ ૧૨/૦૫/૨૦૨૪

ગીરો મિલકતનું વિવરણ

વ્યવસાયિક દુકાન, જુના ગામતલ વિસ્તારમાં બાંધકામ થયેલ, લોહાણા સમાજની વાડી પાસે સ્થિત, ગામ : ફોર્મ નં.૨, એન્ટ્રી નં.૭૮૫૨, ગ્રાઉન્ડ ફ્લોર, દુકાન નં.૧, માપણી બિલ્ટઅપ એરિયા ૧૬.૮૨ સ્કે.મી., સિટી-તલાલા, જીલ્લો ગિરસોમનાથ ૩૬૨૧૫૦. મિલકતની સિમારેખાઓ :

ઉત્તરમાં : ૩૦.૦૦ મીટર પહોળો જાહેર માર્ગ, દક્ષિણમાં : બાકિની મિલકતો પૈકી રહેવાસી ઘર, પૂર્વમાં : દુકાન નં.૨ પશ્ચિમમાં : લધાભાઈ ભોજાભાઈની મિલકત

સ્થળ : તલાલા (ગિરસોમનાથ) તારીખ: ૦૭-૦૮-૨૦૨૪

સહી/- અધિકૃત અધિકારી શ્રી રામ હાઉસિંગ ફાયનાન્સ લી.

Date: 08/08/2024

Place: Ahmedabad

LESHA INDUSTRIES LIMITED

Registered Office. 7th Floor, Ashoka Chambers, Mithakhali Six Road, Ahmedabad 380 006. CIN:L27100GJ1992PLC018607

UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2024.

	(Rs. In Lakhs)			
Particulars	Quarter ended on	Year ended on	Quarter ended on	
	30-06-2024	31-03-2024	30-06-2023	
	Unaudited	Audited	Unaudited	
Total income from operations	674.04	1156.26	67.05	
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	20.73	728.88	7.18	
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	20.73	728.88	636.92	
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	16.89	717.70	631.77	
Total Comprehensive Income for the period [Comprising profit / (Loss) for the period (after tax) and other				
comprehensive income (after tax)]	16.89			
Equity Share Capital	1100.00	1100.00	1100.00	
Reserves (excluding revaluation reserves as shown in the Balance sheet of Previous year)		1443.50		
Earnings Per Share (before extraordinary items) (of				
Re. 1/- each) (not annualised)				
Basic :	0.015	0.65		
Diluted:	0.015	0.65	0.57	
Earnings Per Share (after extraordinary items) (of Re.1/- each) (not annualised)				
Basic:	0.015	0.65	0.57	
Diluted :	0.015	0.65	0.57	
Notes:		<u> </u>		

. The above is an extract of the detailed format of Quarterly/Yearly Financial Results filed with stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Yearly inancial Results are available on the Stock Exchange website (www. bseindia.com) and the company's website (www.lesha.in . The above Financial results are reviewed and recommended by the Audit committee and approved by the Board of Directors at its meeting held on August 08, 2024.

For, LESHA INDUSTRIES LIMITED

Leena A. Shah Managing Director DIN: 02629934

જીસ્ટર્ડ ઓફિસ: આઈસીઆઈસીઆઈ બેંક ટાવર્સ, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્ષ, બાંદ્રા (પૂર્વ), મુંબઈ-૪૦૦૦૫૧. કોર્પારેટ ઓફિસ: આઈસીઆઈસીઆઈ એચએકસી ટાવર, જેબી નગર, અંધેરી કુરલા રોડ, અંધેરી પૂર્વ, મુંબઈ-૪૦૦૦૫૧ શાખા ઓફિસ : પહેલો માળ, શરિક ભિઝ્નેશ સેન્ટરસ યુનાઈટેડ બેંકની ઉપર, મહેસાણા હાઈવે, મહેસાણા - ૩૮૪૦૦૨. શાખા ઓફિસ : ત્રી જો નગર, અંધેરી પૂર્વ, મુંબઈ-૪૦૦૦૫૧ શાખા ઓફિસ : ત્રી થો માળ, ૪૧૦, માઈલસ્ટોન ન્રાઈન્ટ, એપલ હોસ્પિટલની સામે, ઉધના દરવાજા, સુરત - ૩૯૫૦૦૨. શાખા ઓફિસ : ચોથો માળ, ૪૧૦, માઈલસ્ટોન ન્રાઈન્ટ, એપલ હોસ્પિટલની સામે, ઉધના દરવાજા, સુરત - ૩૯૫૦૦૨. શાખા ઓફિસ : પહોર ને . ૩૨, વાર્ડ ને રૂપી, ઓફિસ ને . ૨૦૩, બોલે માળ, ૧૭૧, ના લાખા ઓફિસ : પહોર ને . ૩૨, વાર્ડ ને રૂપી, ઓફિસ ને . ૨૦૩, બોલે માળ, શબ્દ માન ૩૦૦૨૦૧. શાખા ઓફિસ : પહોર ને . ૩૨, વાર્ડ ને રૂપી, ઓફિસ ને . ૨૦૩, બોલે માળ, જો રામ શીખર, ન્યુ સ્ટેશન ચોડ, આર્લદ - ૩૮૮૦૦૧.

ક્રમ નં.	ઉધારકર્તા/સહ-ઉધારકર્તા / જામીનદાર નું નામ (લોન એકાઉન્ટ નંબર) અને સરનામું	મુક્રસ્ટ મિલક્તોનું વર્ણન	ડીમાન્ડ નોટીસની તારીખ / ડીમાન્ડ નોટીસ ની	એ એ
۹.	ફુલાભાઈ ગોબરભાઈ રબારી (ઉધારકર્તા), જવાબેન ફુલાભાઈ રબારી (સહ-ઉધારકર્તા), ૩, બ્રહ્માણીનગર, રાધે ગોવિંદની પાછળ, મહેતાપુરા, હિંમતનગર, ગુજરાત	પ્લોટ નં. ૯, આર.એસ. નં. ૨૯૬/૧/૧ પૈકી, સીટી એસ. નં. ૧/૧/૯, હિંમતનગર નગરપાલિકા મિલકત નં. ૧/૨૦૦૫/૮, મહેતાપુરા, હિંમતનગર, ગુજરાત-૩૮૩૦૦૧. અતુ:સીમા: ઉત્તરે: સાર્જન પછી પ્લોટ નં. ૧૦, દક્ષિણે :	<mark>онडी स्डम (इі.ні)</mark> 20-07-2024 Rs. 27,41,797/-	04/0 202
₹.	૩૮૩૦૧૦. (NHNN00001261953) દેવીલાલ ઘોથાલાલજી જટ (ઉધારકતા), રતનલાલ મદનલાલ ચૌહાજ્ઞ (જામીનદાર), ૧૮૬, વડા પુનિયા કા કુવા ખેડીયા, મું. ખાઢુકડા રાજસર્મદ, રાજસ્થાન-૩૧૩૩૨૬.	પ્લોટ નં. ૬, પૂર્વે : માર્જન પછી પ્લોટ નં. ૮, પશ્ચિમે : ૬.૦૦ મી. પહોળો રોડ. ઘર નં. ૨૧૬, આર.એસ. નં. ૭૫/૩ પી૧, પૈકી પ્લોટ નં. ૪૩ થી ૪૯ પૈકી, સબ પ્લોટ નં. ૪૮/એ, રાજકોટ, પીપલીયા, ગુજરાત - ૩૬૦૦૦૧. ચતુઃસીમા : ઉત્તરે : પ્લોટ નં. ૪૭-સી, દક્ષિણો : પ્લોટ નં. ૪૮બી, પૂર્વે : પ્લોટ નં. ૫૧એ,	20-07-2024 Rs. 3,79,677/-	04/02/02
3.	(NHRAJ00000852952) મોદી શૈલેષકુમાર પી (ઉધારકર્તા), મીનાક્ષીબેન રમણલાલ મોદી (સહ-ઉધારકર્તા), જૈન દાતીવાડા સોસાયટી, મોતી બઝાર, પાલનપુર, ગુજરાત - ૩૮૫૦૦૧.	પશ્ચિમે: રોડ. દુકાન નં. પ, ગ્રાઉન્ડ ફ્લોર, શ્રીધર માર્કેટ, બસ સ્ટેન્ડની પાસે, પાલનપુર સીટી, આર.એસ. નં. ૧૧૭૭૭ પૈકી, પાલનપુર, ગુજરાત - ૩૮૫૦૦૧. ચતુઃસીમા : ઉત્તરે : બિલ્ડીંગની જગ્યા, દક્ષિણે : મંગમ ચેમ્બર્સની મિલકત, પૂર્વે : દુકાન નં.	20-07-2024 Rs. 15,27,204/-	04/
8.	(LHMEH00001340785) અશો કે દેવચંદભાઈ પંચાલ (ઉધારકર્તા), પ્રેમીલાબેન અશોકબાઈ પંચાલ (સહ-ઉધારકર્તા), ડી/૩૦૪, કલ્હાર ગ્રીન્સ, ન્યુ પરાગ સ્કુલ, ગેલેક્ષી રેસીડેન્સીની પાછળ, નરોડા, અનદાવાદ, અપ્રદાવાદ, અપ્રદાત - ૩૮૨૩પ૦. (LHABD00001289730)	૪, પશ્ચિમે : દુકાન તે. ૧૮. પ્લોટ નં. એ/૧૩, રૂપી ઉપવન, સર્વે નં. ૪૯૨, નંદોલ, અંબા તળાવની સામે, દેહગામ, ગુજરાત - ૩૮૨૩૦પ. ચતુઃસીમા : ઉત્તરે : પ્લોટ નં. એ-૬, દક્ષિણે : પ્લોટ નં. એ-૧૪, પૂર્વે : પ્લોટ નં. એ-૧૨, પશ્ચિમે : ૭.૫ મી. સોસાયટી રોડ.	20-07-2024 Rs. 26,74,883/-	09/
u.	રાયાબેન ભરતભાઈ ઝાલા (ઉધારકર્તા), ભરતભાઈ આલજીભાઈ ઝાલા (સહ-ઉધારકર્તા), એ/૨૦૩, મારૂતિ - નંદન રેસીડેન્સી, સાયજ જુનો એડી, ગાંડાકાકા પેટ્રોલ ની સામે, સુરત, સુરત, ગુજરાત -૩૯૪૧૩૦. (LHSUR00001453390)	કલેટ નં. એ/૨૦૩, મારૂતિનંદન રેસીડેન્સી, બિલ્ટ બ્લોક નં. ૭૮, ૭૯ અને ૮૧, રાયે ક્રિષ્ના રેસીડેન્સી, પ્લોટ નં. ૨, શીવ કુંજની બાજુમાં, તાલુકો - ઓલપાડ, મોજે -સાયણ, સુરત, ગુજરાત - ૩૯૪૧૩૦. ચતુ: સીમા ઃ ઉત્તરે : આંતરીક રોડ, બિલ્ડીંગ નં. ડી/૧, વિંગ - ઓ, દક્ષિણ ે: જોડેનો ખુલ્લો બ્લોક અને બ્લોક નં. ૮૨, પૂર્વે: જોડેનો રોડ, પ શ્ચિમે : જોડેનો સી.ઓ.પી.	20-07-2024 Rs. 32,339.67/-	04/
۶.	રાધાબેન ભરતભાઈ ઝાલા (ઉધારકર્તા), ભરતભાઈ આલજીભાઈ ઝાલા (સહ-ઉધારકર્તા), એ/૨૦૩, મારૂતિ - નંદન રેસીડેન્સી, સાયણ જુનો એડી, ગાંડાકાકા પેટ્રોલ ની સામે, સુરત, સુરત, ગુજરાત -૩૯૪૧૩૦. (LHSUR00001453933)	કલેટ નં. એ/૨૦૩, મારૂતિનંદન રેસીડેન્સી, બિલ્ટ બ્લોક નં. ૭૮, ૭૯ અને ૮૧, રાધે ક્રિષ્ના રેસીડેન્સી, પ્લોટ નં. ૨, શીવ કુંજની બાજુમાં, તાલુકો - ઓલપાડ, મોજે -સાયણ, સુરત, ગુજરાત - ૩૯૪૧૩૦. શદુ:સીમા ઃ ઉત્તરે : આંતરીક રોડ, બિલ્ડીંગ નં. ડી/૧, વિગ - ઓ, દક્ષિણે ઃ જોડેનો ખુલ્લો બ્લોક અને બ્લોક નં. ૮૨, પૂર્વઃ જોડેનો રોડ, પ િકામે ઃ જોડેનો સી.ઓ.પી.	20-07-2024 Rs. 4,58,848/-	04/
6.	ચૌધરી દિનેશ ખેંગારજી (ઉંધારકર્તા), ચેતનકુમાર ખેંગારજી ચૌધરી (સહ-ઉંધારકર્તા), યાવરપુરા, તાલુકો -ડીસા, જીલ્લો - બનાસકાંઠા, ગુજરાત, બનાસકાંઠા, ડીસા, ગુજરાત ૩૮પપુરાપ, (LHMEH00001525897)	પ્લોટ નં. ૩૮, અદભુત રેસીડેન્સી, આર.એસ. નં. ૨૫૪/એ/૭, સેત્રુજંય રેસીડેન્સી, ગામ - ભોયાણ, તાલુકો - ડીસા, જીલ્લો - બનાસકાંઠા, ગુજરાત - ૩૮૫૫૩૫. ચતુઃસીમા : ઉત્તરે : પ્લોટ નં. ૩૭, દક્ષિણે : પ્લોટ નં. ૩૮ પૈકી જમીન, પૂર્વેઃ રોડ, પશ્ચિ મે : પ્લોટનં. ૧૬.	20-07-2024 Rs. 11,78,239.52/-	04/0 202
٤.	ચૌધરી દિનેશ ખેંગારજી (ઉધારકર્તા), ચેતનકુમાર ખેંગારજી ચૌધરી (સહ-ઉધારકર્તા), યાવરપુરા, તાલુકો -ડીસા, જીલ્લો - બનાસકાંઠા, ગુજરાત, બનાસકાંઠા, ડીસા, ગુજરાત - ૩૮પપઉપ. (LHMEH00001525898)	છ પ્લોટ નં. ૩૮, અદભુત રેસીડેન્સી, આર.એસ. નં. ૨૫૪/એ/૭, સેત્રુજંય - રેસીડેન્સી, ગામ - ભોયાણ, તાલુકો - ડીસા, જીલ્લો - બનાસકાંઠા, ગુજરાત -		04/0 202
e.	વિસરીયા દિનેશ ગોવિંદભાઈ (ઉધારકર્તા), વિસરીયા ગીતાબેન ગોવિંદભાઈ (સહ-ઉધારકર્તા), જયપ્રકાશનગર, શેરી નં. પ, ભગવતિપરા મેઈન રોડ, રાજકોટ, ગુજરાત - ૩૬૦૦૦૩.(LHRAJ00001464645)	કલેટ નં. ૨૦૨, બીજો માળ, ટાવર - એ, સ્કાય ઉદયત, એસઆરપી કેમ્પની સામે, ન્યુ ૧૫૦ ફુટ રીગ રોડ, મું. ઘટેશ્વર, તાલુકો અને જીલ્લો-રાજકોટ, ઘટેશ્વર, આર.એસ. નં. ૧૪૦/પી૧/પી૧, ટીપીએસ નં. ૩૬/૩, એપી નં. ૪૩/૧, રાજકોટ, ગુજરાત - ૩૬૦૦૦૬. સતુઃસીમા : ઉત્તરે : ફલેટ નં. બી-૨૦૧, દક્ષિષ્ટો : ફલેટનં. એ-૨૦૧, પૂર્વે : કલેટ નં. એ-૨૦૩, પશ્ચિમે : પ્લોટ.	20-07-2024 Rs. 34,74,969/-	04/0 202
۹o.	વિસરીયા દિનેશ ગોવિંદભાઈ (ઉધારકર્તા), વિસરીયા ગીતાબેન ગોવિંદભાઈ (સહ-ઉધારકર્તા), જયપ્રકાશનગર, શેરી નં. પ, ભગવતિપરા મેઈન રોડ, રાજકોટ, ગુજરાત - ૩૬૦૦૦૩.(LHRAJ00001464646)	કલેટ નં. ૨૦૨, બીજો માળ, ટાવર - એ, સ્કાય ઉદયત, એસઆરપી કેમ્પની સામે, ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ, મું. ઘટેશ્વર, તાલુકો અને જીલ્લો -રાજકોટ, ઘટેશ્વર, આર.એસ. નં. ૧૪૦/પી૧/પી૧, ટીપીએસ નં. ૩૯/૩, એરપી નં. ૪૩/૧, રાજકોટ, ગુજરાત - ૩૬૦૦૦૬. સતુઃસીમા : ઉત્તરે : ફલેટ નં. બી-૨૦૧, દક્ષિણો : કલેટનં. એ-૨૦૧, પૂર્વે :કલેટ નં. એ-૨૦૩, પશ્ચિમે :પ્લોટ	20-07-2024 Rs. 1,38,562/-	04/0 202
ાવ.	ઠાકોર આકાશ પ્રહલાદજી (ઉધારકતાં), હેતલબેન કલ્યાણજી ઠાકોર (સહ-ઉધારકર્તા), ૭૪, ઉમીયાપરુ, ઉમીયાપરુ, ઊંઝા, મહેસાણા, ગુજરાત, ગુજરાત - ૩૮૪૧૭૦, ઊંઝા, ગુજરાત - ૩૮૪૧૭૦. (LHMEH00001489249)	તમામ ભાગ અને હિસ્સા સાથેનો ઘર નં. ૮૩, પાટીદાર ગ્રીન્સ, તાલુકો-સિધ્ધપુર, આર.એસ. નં. ૨૦૯/પી૧, ખોલવાડા સીમ, જીલ્લો - પાટલ, ગુજરાત - ૩૮૪૨૬પ. ચતુઃસીમા : ઉત્તરે : ઘર નં. ૮૪, દક્ષિણે : ઘર નં. ૮૨, પૂર્વે : આંતરીક રોડ, પશ્ચિમે : ઘર નં. ૯૦.	20-07-2024 Rs. 20,70,383/-	04/0 202
૧૨.	ઠાકોર આકાશ પ્રહલાદજી (ઉધારકર્તા), હેતલબેન કલ્યાજ્ઞજી ઠાકોર (સહ-ઉધારકર્તા), ૭૪, ઉમીયાપર, ઉમીયાપર, ઊંઝા, મહેસાણા, ગુજરાત, ગુજરાત - ૩૮૪૧ ૭૦, ઊંઝા, ગુજરાત - ૩૮૪૧૭૦. (LHMEH00001489251)	તમામ ભાગ અને હિસ્સા સાથેનો ઘર નં. ૮૩, પાટીદાર ગ્રીન્સ, તાલુકો-સિધ્ધપુર, આર.એસ. નં. ૨૦૯/પી૧, ખોલવાડા સીમ, જીલ્લો - પાટણ, ગુજરાત - ૩૮૪ ૬૧૫. સ્તુ:સીમા : ઉત્તરે : ઘર નં. ૮૪, દક્ષિણે : ઘર નં. ૮૨, પૂર્વે : આંતરીક રોડ, પશ્ચિમે : ઘર નં. ૯૦.	20-07-2024 Rs. 1,01,428.99/-	04/ 20
93.	જતિનકુમાર અશોકભાઈ રાવલ (ઉધારકર્તા), પિસ્તાદેવી (સહ-ઉધારકર્તા), પ્લોટ નં. ૫૫, શ્યામ સુંદર રેસીડેન્સી, વાવગામનીપાસે, કામરેજ, કામરેજ, ગુજરાત - ૩૯૪૧૮૦. (LHSUR00001497226)	કલેટ નં. જી-૩, કુમકુમ એપાર્ટમેન્ટ, શ્રી શામળા એપાર્ટમેન્ટની પાસે, દાદા ભગવાન મંદિર રોડ, બ્લોક નં. ૩૫૭, મોજે-કામરેજ, સુરત, ગુજરાત - ૩૯૪૧૦૧. ચતુઃસીમા : ઉત્તરે : ૪.૦૫ મી. પહોળો માર્જીન જમીન, દક્ષિણે : ૪.૦૫ મી. પહોળો માર્જીન જમીન, પૂર્વે : સિમધર નગરની જમીન પછી બ્લોક, પશ્ચિમે :૭.૫૦મી. પહોળો રોડ.	20-07-2024 Rs. 27,160/-	04/ 20
98.	જતિનકુમાર અશોકભાઈ રાવલ (ઉધારકર્તા), પિસ્તાદેવી (સહ-ઉધારકર્તા), પ્લોટ નં. પપ, શ્યામ સુંદર રેસીડેન્સી, વાવગામની પાસે, કામરેજ, કામરેજ, ગુજરાત - ૩૯૪૧૮૦. (LHSUR00001497500)	કલેટ નં. જી-૩, કુમકુમ એપાર્ટમેન્ટ, શ્રી શામળા એપાર્ટમેન્ટની પાસે, દાદા ભગવાન મંદિર રોડ, બ્લોક નં. ૩૫૭, મોજે-કામરેજ, સુરત, ગુજરાત - ૩૯૪૧૦૧. ચતુ:સીમા : ઉત્તરે : ૪.૦૫ મી. પહોળો માર્જીન જમીન, દક્ષિણે : ૪.૦૫ મી. પહોળો માર્જીન જમીન, પૂર્વ : સિમધર નગરની જમીન પછી બ્લોક, પશ્ચિમે : ૭.૫૦ મી. પહોળો રોડ.	20-07-2024 Rs. 6,10,413/-	04/ 20
٩u.	કેતનકુમાર (ઉધારકતાં), કાંતાદેવી (સહ-ઉધારકતાં), ૩૯, આધુષ ગ્રીન વિલા - ૨, મહેસાણા, મહેસાણા, ગુજરાત - ૩૮૪૦૦૨. (LHMEH00001438167)	સી-૪૦૪, ચોથો માળ, મણીધર હાઈટ્સ, આર.એસ. નં. ૩૩૭, જુનો આર. એસ. નં. પ૦પી, દ૪પ, દ૪૬, ૬૪૭, ૬૪૮, ૬૫૦/૧, તાલુકો - બેચરાજી, જીલ્લો - મહેસાણા, ગુજરાત - ૩૮૪૦૦૩. ચતુઃસીમા : ઉત્તરે : સી ફેસ રો હાઉસ રોડ, દક્ષિણે : ફ્લેટ નં. સી-૪૦૩, પૂર્વે : સી ફેસ રો હાઉસ રોડ, પ શ્ચિમે : ફ્લેટ નં. સી-૪૦૧.	20-07-2024 Rs. 82,026/-	20
૧૬.	કેતનકુમાર (ઉધારકર્તા), કાંતાદેવી (સહ-ઉધારકર્તા), ૩૯, આયુષ ગ્રીન વિલા - ૨, મહેસાણા, મહેસાણા, ગુજરાત - ૩૮૪૦૦૨. (LHMEH00001438168)	સી-૪૦૪, ચોથો માળ, મણીધર હાઈટ્સ, આર.એસ. નં. ૩૩૭, જુનો આર. એસ. નં. ૫૦પી, ૬૪૫, ૬૪૬, ૬૪૦, ૬૪૮, ૬૫૦/૧, તાલુકો - બેચરાજી, જીલ્લો - મહેસાણા, ગુજરાત - ૩૮૪૦૦૩. ચતુઃસીમા : ઉત્તરે : સી ફેસ રો હાઉસ રોડ, દક્ષિણ : ફ્લેટનં. સી-૪૦૩, પૂર્વે : સી ફેસ રો હાઉસ રોડ, પશ્ચિમે : ફલેટનં. સી-૪૦૧.	20-07-2024 Rs. 17,26,757/-	04/ 20
૧७.	ધ્યાની મહેશ વલ્લભજી (ઉધારકર્તા), શીતલ મહેશભાઈ ધ્યાની (સહ-ઉધારકર્તા), રામેશ્વર કોલોની, લાઈટ હાઉસની પાસે, માંડવી, કચ્છ, કચ્છ, માંડવી, ગુજરાત - ૩૭૦૪૬પ. (LHGDM00001480322)	પ્લોટ નં. ૮, ઘનશ્યામનગર - ૨, માંડવી લાયજા રોડ, ધવલનગરની પાસે, તાલુકો - માંડવી, આર.એસ. નં. ૨૧૭, કચ્છ, ગુજરાત - ૩૭૦૪૬૫. ચતુ:સીમા : કિત્તરે : ઘર નં. ૭/૮-બી, દિક્ષણે : પ્લોટ નં. ૯, પૂ ર્વે : સર્વે નં. ૨૧૬, ઘનશ્યામ, પશ્ચિમે : ૬ મી. પહોળો આંતરીક રોડ.	20-07-2024 Rs. 20,80,382.42/-	04/ 20
૧૮.	ધ્યાની મહેશ વલ્લભજી (ઉધારકર્તા), શીતલ મહેશભાઈ ધ્યાની (સહ-ઉધારકર્તા), રામેશ્વર કોલોની, લાઈટ હાઉસની પાસે, માંડવી, કચ્છ, કચ્છ, માંડવી, ગુજરાત - ૩૭૦૪૬ પ. (LHGDM00001480324)	પ્લોટ નં. ૮, ઘનશ્યામનગર - ર, માંડવી લાયજા રોડ, ધવલનગરની પાસે, તાલુકો - માંડવી, આર.એસ. નં. ૨૧૭, કચ્છ, ગુજરાત - ૩૭૦૪૬પ. ચહુ:સીમા : ઉત્તરે : ઘર નં. ૭/૮-બી, દક્ષિણો : પ્લોટ નં. ૯, પૂ ર્વે : સર્વે નં. ૨૧૬, ઘનશ્યામ, પશ્ચિમે : દ મી. પહોળો આંતરીક રોડ.	20-07-2024 Rs. 92,325.58/-	04. 20
૧૯.	દોલાઈ ઉત્તમ બાણેશ્વર (ઉધારકતો), દોલાઈ અનિતા ઉત્તમ (સહ-ઉધારકતો), ૪૬, કુબેરનગર પીટીસી કોલેજની સામે, પાટલ - ૩૮૪૨૬૫, પાટલ, ગુજરાત - ૩૮૪૨૬૫. (LHMEH00001448939)	પ્લોટ નં. ૪૬, કુબેરનગર, આર.એસ. નં. ૯૨૧/પી, પીટીસી કોલેજની સામે, મોજે - સામલપતિ, તાલુકો અને જીલ્લો - પાટણ, ગુજરાત - ૩૮૪૨૬પ. સ્રતુ:સીમા : ઉત્તરે : રોડ, દક્ષિણે : કોમન પ્લોટ નં. ૦૧, પૂર્વે : પ્લોટ નં. ૪૫, પશ્ચિમે: આર.એસ.નં. ૯૨૩.	20-07-2024 Rs. 4,39,168/-	04, 20
₹0.	દોલાઈ ઉત્તમ બાલેશ્વર (ઉધારકર્તા), દોલાઈ અનિતા ઉત્તમ (સહ-ઉધારકર્તા), ૪૬, કુબેરનગર પીટીસી કોલેજની સામે, પાટલ - ૩૮૪૨૬૫, પાટલ, ગુજરાત - ૩૮૪૨૬૫. (LHPAA00001260562)	પ્લોટ નં. ૪૬, કુબેરનગર, આર.એસ. નં. ૯૨૧/પી, પીટીસી કોલેજની સામે, મોજે - સામલપતિ, તાલુકો અને જીલ્લો - પાટણ, ગુજરાત - ૩૮૪૨૬૫. સતુ:સીમા: ઉત્તરે : રોડ, દક્ષિણે : કોમન પ્લોટ નં. ૦૧, પૂર્વે : પ્લોટ નં. ૪૫, પશ્ચિમે: આર.એસ. નં. ૯૨૩.	20-07-2024 Rs. 4,57,975.99/-	04. 20
૨૧.	દોલાઈ ઉત્તમ બાણેશ્વર (ઉધારકર્તા), દોલાઈ અનિતા ઉત્તમ (ત્ત્રહ-ઉધારકર્તા), ૪૬, કુબેરનગર પીટીસી કોલેજની સામે, પાટલ - ૩૮૪૨૬૫, પાટલ, ગુજરાત - ૩૮૪૨૬૫. (LHPAA00001274686)	પ્લીટ નં. ૪૬, કુબેટનગર, આર.એસ. નં. ૯૨૧/પી, પીટીસી કોલેજની સામે, મોજે - સામલપતિ, તાલુકો અને જીલ્લો - પાટણ, ગુજરાત - ૩૮૪૨૬૫. સતુઃસીમા : ઉત્તરે : રીડ, દક્ષિણે : કોમન પ્લીટ નં. ૦૧, પૂર્વે : પ્લીટ નં. ૪૫, પશ્ચિમે : આર.એસ. નં. ૯૨૩.	20-07-2024 Rs. 38,451/-	20
₹₹.	(જામીનદાર), ઘર નં. ૨૭૯, ઉત્તર ફળીયા, લવાચા, વાપી, ગુજરાત - ૩૯૬૧૯૧. (LHVPI00001542686)	કલેટ ને. પ૦૫, પાંચમાં માળ, રાધે કિખા એપાર્ટમેન્ટ, જય ભરતનગર, કોપારલી રોડ, વલલભગરાની પાસે, મુંં .છીલી, જુનો સર્વે નં. ૧૫૮/૧/ર, ન્યુ સર્વે નં. ૧૦, તાલુકો-વાપી, જીલ્લો-વલસાડ, ગુજરાત-૩૯૬૧૯૧. ચતુઃસીમા ઃ ઉત્તરે ઃ ખુલ્લી જગ્યા, દક્ષિણે ઃ કલેટ નં. પ૦૬, પૂર્વે ઃ ખુલ્લી જગ્યા, પશ્ચિમે ઃ જગ્યા.	20-07-2024 Rs. 19,58,037/-	09/ 20
	નરેન્દ્ર પ્રભુભાઈ પટેલ (ઉધારકતાં), સિંઘ રાજેશ રામપુકાર (જામીનદાર), ઘર નં. ૨૭૮, ઉત્તર કળીયા, લવાચા, વાપી, ગુજરાત - ૩૮૯૧૯૧. (LHVPI00001542929) સ્વ. યાદવ સ્વામીજી પરમાત્મા (ઉધારકર્તા), અર્ચના	કલેટ નં. પ૦૫, પાંચમો માળ, રાધે કિખા એપાર્ટમેન્ટ, જય ભરતનગર, કોપારલી રોડ, વલલભનગરની પાસે, મું .છીલી, જુનો સર્વે નં. ૧૫૮/૧/૨, ન્યુ સર્વે નં. ૧૦, તાલુકો-વાપી, જીલ્લો-વલસાડ, ગુજરાત-૩૯૬૧૯૧. વશુ:સીમા : ઉત્તરે: ખુલ્લી જુગ્યા, દક્ષિણ : કલેટ નં. ૫૦૬, પૂર્વે : ખુલ્લી જુગ્યા, પશ્ચિમે : જુગ્યા.	20-07-2024 Rs. 91,087/-	09,
₹8.	(કાયદેસર ના વારસદાર-W/o સ્વ. યાદવ સ્વામીજી પરમાત્મા) (ઉધારકર્તા), એલ-૧૦૧, નંદનગર, છાણી, વડોદરા, ણાણી, ગુજરાત-૩૯૧૭૪૦. (LHBRD00001480784)	પહેલાં માળ, કુંજ પ્લાઝા અને પેરેડાઇઝ, ફોચ્યુન ગેટવે ની સામે, ગુરુ ગોવિદસિંઘ માર્ગસ છાણી, વડોદરા, આર.એસ. નં. ૯૫/પી, ટીપી નં. ગર, દુકાન નં. એફઇ/૦૮, વડોદરા, ગુજરાત - ૩૯૧૭ ૦૦. ચતુ:સોમા : ઉત્તરે : ૧૮ મી. ટીપી રોડ, દક્ષિણે : ૫ ફુટ કોમન જગ્યા, પૂર્વે : દુકાન નં.એફએફ૮, પશ્ચિમે : દુકાન નં.એફએફ૧૦.	25-07-2024 Rs. 2,16,036.15/-	20
	ગોહેલ દર્શિતકુમાર હરગોવિંદભાઈ (ઉધારકર્તા), પીઠડીયા કિખાબેન અશોકભાઈ (સહ-ઉધારકર્તા), પ્રતિક હરગોવિંદ ભાઈ ગોહેલ (સહ-ઉધારકર્તા), સાતક પોળ, ઉમરેઠ, આણંદ, ઉમરેઠ, ગુજરાત - ૩૮૮૨૨૦. (LHAND00001456181)	સીટી સર્વે નં. ૩૧૮૮, કુલ ક્ષેત્રફળ ૪૩.૪૭૮૭, સાતક પોળ, દલાલ પોળની પાસે, બઝાર મું. તાલુકો - ઉમરેઠ, ગામ - ઉમરેઠ, જીલ્લો - આણંદ, ગુજરાત - ૩૮૮૨૨૦. ચતુઃસીમા : ઉત્તરે : કળીયા રોડ, દક્ષિણે : બળવંત એમ શાહની મિલકત, પૂર્વે : કળીયા રોડ, પશ્ચિમે : કળીયા રોડ.	20-07-2024 Rs. 11,72,640.35/-	09/
રક.	ગોહેલ દર્શિતકુમાર હરગોવિંદભાઈ (ઉધારકતાં), પીઠડીયા ક્રિપ્નાબેન અશોકભાઈ (સહ-ઉધારકર્તા), પ્રતિક હરગોલી ભાઈ ગોહેલ (સહ-ઉધારકર્તા), સાતક પોળ, ઉમરેઠ, આણંદ, ઉમરેઠ, ગુજરાત - ૩૮૮૨૨૦. (LHAND00001456182)	સીટી સર્વે નં. ૩૧૮૮, કુલ ક્ષેત્રફળ ૪૩.૪૭૮૭, સાતક પોળ, દલાલ પોળની પાસે, બઝાર મું. તાલુકો - ઉમરેઠ, ગામ - ઉમરેઠ, જીલ્લો - આણંદ, ગુજરાત - ૩૮૮૨૨૦. ચતુઃસીમા : ઉત્તરે : ફળીયા રોડ, દક્ષિણે : બળવંત એમ શાહની મિલકત, પૂર્વે : ફળીયા રોડ, પશ્ચિમે : કળીયા રોડ.	20-07-2024 Rs. 6,73,163/-	20

કર્યાની તારીખ થી ૬૦ દિવસની એંદર બાકી ની ચુકવણી કરી, નિષ્ફળ જાય પછી આગળનાં પગલાં લેવામાં આવશે, નોટીસ જારી કરવામાં આવેલ ૬૦ દિવસની નોટીસ ગણવી.

Sunlite Recycling Industries IPO To Open On 12th August

Ahmedabad. Recycling Industries is engaged in the business of manufacturing of copper rods & wires, copper earthing wires, copper earthing strips, copper conductors, copper wire bars etc. through recycling of copper scrap, which has electrical and mechanical properties suitable for applications in power generation, transmission, distribution and electronic industries. Products are sold in 10+ States & Union territories. The company is poised for its initial public offering (IPO), with plans to raise INR 30.24 crores through the issuance of 28.8 lakh new shares. Copper is one of the most recycled metals,

Sunlite tensile strength, high ductility, excellent creep and corrosion resistance, high thermal conductivity, enabling conservation of natural resources & mitigate associated pollution. For its SME Initial Public Offering (IPO), Sunlite Recycling Industries has established a price band of Rs 100 to Rs 105per share. The company's shares will open for subscription on August 12, 2024 and closes on August 14, 2024. These will be listed on the NSE SME, with a projected listing date of Tuesday, August 20, 2024. Hem Securities Limited is the book running lead manager of the Sunlite Recycling Industries IPO, while Cameo Corporate Services Limited is the registrar for the issue. (1-7)

Sonalika surpasses 50K overall tractor sales mark in just 4 months



possessingqualities such as high

Ahmedabad, India's No. 1 tractor export brand Sonalika is known for delivering joy and unmatched unparalleled satisfaction to farmers with its fuel-efficient heavy duty tractors. Starting off its Q2 FY'25 leg, 'Pride of India' Sonalika Tractors has achieved a new benchmark performance to surpass 50K overall tractor sales in just 4 months of FY'25 and clocked an overall YTD sales of 51,268 tractors in Apr-July'24. Riding the robust growth trajectory, the company has leading market share outperformed the domestic gainers." (13-9)

continues to be among leading market share gainers in the domestic market. The performance has also set the brand's momentum as the tractor industry prepares for the biggest season in the coming months. Sharing his thoughts on the staggering performance, Mr Raman Mittal, Joint Managing Director, International Tractors Limited, said, "We are delighted to have surpassed 50K tractor sales mark in just 4 months to clock an overall YTD July'24 sales of 51,268 tractors. Our robust approach has enabled us to continue beating domestic industry performance and be among

market performance and

Toyota Technical Training Institute Marks the Convocation



Ahmedabad, Technical Training Institute Automotive Skills Development (TTTI) today celebrated the Council (ASDC), National Skill convocation of its 15th batch of students in a grand (NSDC) and Toyota Technical ceremony, marking the successful completion of its Toyota Indonesia Academy, comprehensive skill training on who participated to foster Global Manufacturing Practicesalong with holistic development of knowledge, skill, body and attitude. This milestone event recognized58 Regular TTTI students and 156 Toyota Kaushalya course students from rural Karnataka. The academic honours were bestowed upon the graduates by the esteemed Chief Guest, his holiness Jagadguru Sri Shivarathri Deshikendra Mahaswamiji, in the presence excellent job opportunities in of TKM Management, Karnataka, across India, and representatives from Toyota overseas. (20-4)

Toyota Group Companies, Suppliers, Development Corporation Skill Academy - Japan,the knowledge sharing among Toyota affiliates. Since its inception in 2007, TTTI has focused on imparting advanced technology knowledge and fostering overall development by transforming rural youth into skilled manpower tailored to industry needs. A key factor in TTŤI's success is its consistent 100% employment rate, with students securing

Mercedes-Benz launches two top-end vehicles in India



Ahmedabad, Mercedes-AMG GLC 43 4MATIC Coupé debuts for the first time with the handcrafted exclusivity of India; combining thrilling, Grand Prix-level performance of an AMG, with stunning aesthetics of an SUV Coupé. line adds to Mercedes-Benz's desirable portfolio of CLE 300 on the other hand cabriolets, offering the combines timeless elegance of liberating experience of open- a cabriolet, with sporty top motoring to customers.

vehicles for the Indian customers performance and lifestyle vehicles. Our Top-End Vehicles (TEV) continue to drive strong customer loyalty and these two vehicles will further enhance the desirability of the TEV segment. For the first time, we are debuting the AMG GLC 43 SUV Coupé with the exclusivity of 'One man, One Engine' in India, making 'One man, One Engine' in cutting-edge motorsports technology accessible to customers. The AMG GLC 43 SUV has been the most successful AMG in India, the The CLE 300 cabriolet AMG new model will further enhance its popularity. The dynamics; continuing

two highly desirable top-end

"With GLC 43 4MATIC Mercedes-Benz's rich tradition Coupé and CLE 300 Cabriolet of making open-air dream AMG Line, we are launching cars." (1-7)

Printed and Published by MAYUR C. BHATT on behalf of KALYANI PUBLIATION PVT. LTD. and Printed at : Dharti Printers C-3, Shankar Chember, Nr. Fadia Chamber, Asharam Road, Ahmedabad-Published From KALYANI PUBLIATION PVT. LTD. 201,202,208 Nandan complex, opp mithakhali rly crossing, mithakhali, ahmedabad. Editior: Mayur C.

Rajkot-Ahmedabad sixlane work at a snail's pace

Six years passed, 2 bridges and 7 km of tarmac left, deadline extended five times, people not freed from traffic

connecting Ahmedabad to Rajkot in Gujarat, the deadline has been extended five times extension on the extensions, the operation of the six-lane, which started in 2018, has not been completed by early August 2024, even after 6

how much is Mama's house... that 98% of the ?3350 crore If the lamp is burning... project has been completed Something similar is and the work will be happening in the six-lane completed in the next 3 construction of National months, but the reality is that Highway (NH) No. 47 whether the work will be completed even by the end of 2024 is a big question. Even though 6 years have passed, in a row. Despite the still 2 of the major 6 bridges of this project are yet to be completed. As much as 7 km of asphalt work is still to be done. Also, the design for Hirasar airport has been years. The current situation is modified and sent to the expected to be completed by government for approval, for

Nephro Care India Ltd sets up a renal care unit at Alipurduar in West Bengal



Ahmedabad, City-based Nephro Care India Ltd (NCIL) has set up a renal carè clinic at Alipurduar in West Bengal to cater to the growing demand for advanced diagnostic and pharmacy support for kidney patients in the State. Plans are afoot to take the total number of renal care clinics to 22 by March 2026, of which nine units will be established across the various districts of the State.

NCIL, which is a leading multi-speciality healthcare provider in East India, offers a wide range of clinical and lifestyle solutions and renal insufficiency treatment to patients with the treatment across the country in the next framework covering the entire 10-15 years. (13-1)

range of lifestyle, physiological and spiritual aspects of wellness. Government estimates suggest, nearly 2,20,000 patients develop ESRD (end stage renal disease) in India, leading to an additional annual dialysis demand of 34 million treatment sessions. However, India presently has nearly 5,000 existing dialysis centres (including 1353 centres under PMNDP). This capacity will not be sufficient to meet the upcoming demand as the disease has been gaining traction due to various sociological, lifestyle and environmental factors, Dr Pratim Sengupta, a senior nephrologist and MD of Nephro Care India, said, highlighting the need for setting up more such centres across the country. NCIL has a vision of reaching out and impacting lives of close to one million patients suffering from chronic kidney disease by

setting up 300 such centres

Shrijee Lifestyle Group Targets Rs.1200 Crore Turnover by 2030

Sustainable Fashion and AI Integration Established by Mr Deshbandhu Kagzi in the year 1970, SHRIJEE brand started well known for its 2x2 Rubia. This commitment to innovation and quality was furthered by his son, Brijendra Kagzi, who nternational markets like UK, EU , Middle East & Latin brands across India and cinemas for INR 300, sofa America. Shrijee Lifestyle abroad. (1-7) Group has become a recognized force in shirting, women's wear, and kids wear, known for its value-added and digitally printed fabrics. Brijendra Kagzi, Chairman & Managing Director of Shrijee Lifestyle Group continues to steer the Group towards new heights, backed by a New Dynamic Team led by his elder son, Abhay Kagzi, and supported by his younger son, Krishang Kagzi. This new generation is energizing the company by leveraging Shrijee's core strengths and loyal customer base, while harnessing modern tools like AI (Artificial Intelligence) and

Ahmedabad, Pioneering analytics to drive growth. Shrijee Lifestyle Group achieved a turnover of Rs.400 crore in 2023-24, which is expected to reach Rs. 500 as a leader in blouse fabrics, crore in 2024-25. The Gen Z leadership has charted a roadmap to achieve Rs.1200 crore turnover for the Group by 2030, focusing on expanding expanded the company's the product portfolio, while footprint pan India and continuing to grow the reach of the company's established

CORRIGENDUM

Branch Office: ICICI Bank Ltd., Office
Number 201-B, 2nd Floor, Road No. 1 Plot
No-B3, WIFI IT Park, Wagle Industrial
Estate, Thane, Maharashtra- 400604

cinemas for INR

This is with reference to the captioned SARFAESI 13 (2) Notice dated June 09, 2021 (hereinafter referred to as 'the said Notice') towards your aforementioned Home loan Account No. QZSUR00005035926 in the borrower name Amitbhai Ashwinbhai Chudasama with ICICI Bank Ltd We wish to mention that inadvertently and unintentionally proper address & area admeasuring is mistakenly mentioned as Plot No. 110 Sajan Homes, Nr. Nansad Lake, Moje Nansad, Kamrej, Gujarat, SURAT 394210. Admeasuring an area of AS PER SALE DEED Therefore reques you to please read it as below Plot No.110, (As Per K.J.P CORRECTION Block No.130/2/110) Revenue Survey No.102, Old Block No.116, (Re Survey New Block No.130) Sub Plot No.2, Sajan Homes, Nr. Nansad Lake,Moje Nansad, Kamrej, Gujarat, SURAT- 394210. Admeasuring Plot area 40.19 SQMT with undivided share in Road and C.O.P 29.10 sq.metres Total admeasuring area 69.29 sq.metres All other details mentioned in the said SARFAESI 13 (2) Notice will

We sincerely regret the inconvenience caused to you in this regard.

Date: August 09, 2024 Place: Surat Authorized Officer ICICI Bank Limited

LESHA INDUSTRIES LIMITED Registered Office. 7th Floor, Ashoka Chambers, Mithakhali Six Road, Ahmedabad 380 006.

UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2024.

	(Rs. In Lakhs)				
Particulars	Quarter ended on	Year ended on	Quarter ended on		
	30-06-2024	31-03-2024	30-06-2023		
	Unaudited	Audited	Unaudited		
Total income from operations	674.04	1156.26	67.05		
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional					
and/or Extraordinary items)	20.73	728.88	7.18		
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	20.73	728.88	636.92		
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	16.89	717.70	631.77		
Total Comprehensive Income for the period [Comprising profit / (Loss) for the period (after tax) and other					
comprehensive income (after tax)]	16.89	717.70			
Equity Share Capital	1100.00	1100.00	1100.00		
Reserves (excluding revaluation reserves as shown in the Balance sheet of Previous year)		1443.50			
Earnings Per Share (before extraordinary items) (of Re. 1/- each) (not annualised)					
Basic :	0.015	0.65	0.57		
Diluted:	0.015	0.65	0.57		
Earnings Per Share (after extraordinary items) (of Re.1/- each) (not annualised)					
Basic :	0.015	0.65	0.57		
Diluted :	0.015	0.65	0.57		

1. The above is an extract of the detailed format of Quarterly/Yearly Financial Results filed with stock Exchange under Regulatio 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Yearl inancial Results are available on the Stock Exchange website (www. bseindia.com) and the company's website (www.lesha.ir . The above Financial results are reviewed and recommended by the Audit committee and approved by the Board of Director

at its meeting held on August 08, 2024.

Date: 08/08/2024 Place: Ahmedabac

Raikot, Children are saying December. It is being claimed which the approval of the project is claimed to be 98% government is awaited.

> NH 47 stretches from Jamnagar in Gujarat via Indore in Madhya Pradesh to Nagpur in Maharashtra. It may be mentioned that the work has started on Sarkhej-Gandhinagar (SG) highway NH 147 connecting Ahmedabad to Gandhinagar upto Sanand Chowk near Karnavati Club, Prahladnagar Junction and YMCA Club.

In October 2017, at the hands of Narendra Modi,in the year 2011, the National Highway Authority of India started considering to convert the Raikot Ahmedabad highway from four lanes to six lanes, connecting Saurashtra's capital Rajkot with Gujarat's economic capital Ahmedabad. After that, this project was sealed by Prime Minister Narendra Modi in the month of October 2017. At that time the Chief Minister of Gujarat was Vijay Rupani. After that in the year 2018, the road construction work was started. However, Sixlane is still not ready even after more than 6 years since

complete and the work will be completed in the next 3 months, but the work is not expected to be completed by the end of December 2024.

Agencies fail to meet

deadlines Rajkot-Ahmedabad six-lane highway is being given repeated dates by the road construction agency. First of all, this project, which started in the year 2018, was announced to be completed in the year 2020. However, the work could not be completed then and its deadline was extended to 30 June 2023. However, despite this, the work was not completed and another 6 months was given and then a reply was presented in the Assembly House by the Margamkan Department that the work would be completed in March 2024. That is, today one more date is being given as the work is not completed even during this time. Claiming that 98% of the project has been completed, Rajkot-Ahmedabad Six Lane Highway project is being claimed to be

completed before Diwali in the

Cinépolis Celebrates Cinema Lovers Day with Rs 99 Tickets to Reignite the Magic of Movie-Going

Khatamuhurat. Today, the next 3 months.

Ahmedabad, Cinépolis

India, the first international

movie-going experience. As a

token of appreciation for our

loyal patrons and to rekindle

the joy of movie-going,

Cinépolis is offering an

seats/Macro XE/Junior for

INR 150, and IMAX/4DX for

For, LESHA INDUSTRIES LIMITED

Leena A. Shah

Managing Director DIN: 02629934



INR 250. Mr. Devang Sampat, Managing Director of Cinépolis India, commented cinema exhibitor, is thrilled to announce a special initiative on this initiative and said, "At Cinépolis, we are deeply to rejuvenate the excitement and enthusiasm for the committed to enriching the movie-going experience beyond just attractive offers. Cinema Lovers Day is not just about affordable tickets; it's about celebrating the magic exclusive ticket pricing for one of cinema. We want to offer day only on Cinema Lovers a holistic experience that Day, 9th August 2024. captures the essence of storytelling and community, Traditional seats will be available for INR 99 or INR creating lasting memories for 100, recliners in traditional our audience that they will cherish for a lifetime. This initiative is a testament to our dedication to bringing people together to share the communal joy of watching films on the big screen." (19-10)

CORRIGENDUM Rank Branch Office: ICICI Bank Ltd., Office Number 201-B, 2nd Floor, Road No. 1 Plot No-B3, WIFI IT Park, Wagle Industrial Estate, Thane, Maharashtra- 400604

This is with reference to the captioned SARFAESI 13 (2) Notice dated June 18, 2021 (hereinafter referred to as 'the said Notice') towards your aforementioned Home loan Account no. QZSUR00005035096 in the borrower name Radheshyam Mahendra Singh with ICICI Bank Ltd. We wish to mention that inadvertently and unintentionally property address & area admeasuring is mistakenly mentioned as Plot No. 676, Gokuldham Residency, Nr. Tatithaiya Railway Crossing, Moje-Tatithaiya, Palsana, SURAT- GUJARAT, SURAT- 220309. (Admeasuring an area of AS PER SALE DEE)

Therefore request you to please read it as below Plot No.676(Plot No.246)

an area of ASPERSALE DEE)
Therefore request you to please read it as below Plot No.676(Plot No.246 as per approved Plan), Block No.286/K, R.S. No.360/1A, 360/2, 343/1, Gokuldham Residency, Nr. Tatithaiya Railway Crossing, Moje Tatithaiya, District Palsana, SURAT- GUJARAT, SURAT- 220309, Admeasuring an area 40.18 SQMT As per K.J.P., As per Site admeasuring an area 40.13 SQMT i.e. 48.00 sg.yards along with undivided share in road and COP admeasuring 24.97 sq.metres

All other details mentioned in the said SARFAESI 13 (2) Notice will remain

We sincerely regret the inconvenience caused to you in this regard.

Authorized Officer ICICI Bank Limited Date: August 09, 2024 Place: Surat

SHRIRAM HOUSING FINANCE LIMITED Reg.Off.: Office No.123, Angappa Naicken Street, Chennai-60000

SHRIR 🖍 M | Head Office : Level 1, Wockhardt Towers, East Wing, C-2, HOUSING FINANCE | G Block, Bandra-Kurla Complex, Mumbai 400 051 Website: http://www.shriramhousing.in **SYMBOLIC POSSESSION NOTICE**

Whereas, The undersigned being the authorised officer of Shriram Housing Finance Limited (SHFL) under the provisions of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act. 2002 (said Act) and in exercise of powers conferred under Section 13(12) of the said Act read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 (said Rules) issued demand notices to the Borrowers details of which are mentioned in the table below to repay the amount mentioned in the said demand

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers and the public in general that the undersigned has taken SYMBOLIC POSSESSION of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with rule 8 of the said Rules on 07/08/2024.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealing with the property will be subject to the charge of Shriram Housing Finance Ltd. for an amount as mentioned herein

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Borrower's Name and Address

1. Kotadiya Nandlal Muljibhai,

Present Address :- Chora Vali Sheri, Patel vada, Talala, Gir-Somnath-362510 Also: Kotadiya Nandlal Muljibhai,

Property Address:- Shop No.1 from west side, Harekrushna provision store, Ground Floor, Nr.Lohana samai vandi, Off.station road, Talala, Gir-Somnath-362510

Present Address:-Chora Vali Sheri, Patel vada, Talala, Gir-Somnath-362510 Also :- Kotadiya Shilpaben Nandlal.

Property Address: - Shop No.1 from west side. Harekrushna provision store. Ground Floor, Nr.Lohana samaj vandi, Off.station road, Talala, Gir-Somnath-

Amount due as per Demand Notice

Rs. 24,25,858/- (Rupees Twenty Four Lakh Twenty Five Thousand Eight Hundred Fifty Eight Only) as on 07-05-2024 under reference of Loan Account No. SLPHVRVL0000201 with further interest and other costs, charges and expenses within 60 days from the date of receipt of the said notice 13(2) Notice Date. 12/05/2024

Description of Mortgaged Property

A Commercial Shop constructed at Old Gamtal Area, situated at Nr.Lohana Samai Vandi, Village: Form No.2, Entry No.7852, Ground Floor, Shop No.1, admeasuring built up area Sq.Mt.16.82, city: Talala, District: Gir-Somnath-

Boundaries of the property :- North :- 30.00 Mt. wide public road, South: remaining property paiki residential house., East: Shop No.2, West: Property of Ladhabhai Bhoiabhai

Place: Talala(Gir-Somnath) Date: 07-08-2024

Sd/- Authorised Office Shriram Housing Finance Limited



दिल्ली विश्वविद्यालय UNIVERSITY OF DELHI

Advt. No. R&P/303/2024

Dated: 27.06.2024

Online applications are invited in the prescribed Application Form from the eligible candidates for appointment to the post of Principal, University College of Medical Sciences (UCMS). The post carries Scale of Pay Level 14 as per VII CPC Pay Matrix. The last date for receipt of applications is within two weeks from the date of publication of the advertisement in the *Employment News*. For details, please visit the University website www.du.ac.in and click "Jobs and Opportunities" under the Head "Work with

Any addendum/corrigendum shall be posted only on the University website.

REGISTRAR

Important Note:

The details regarding qualifications, experience etc. are available on the University website www.du.ac.in, along with this advertisement. The applicants are required to read these details before filling up the form.

Piramal

Pir

	E-auction Subsequent Sale Notice, E-auction Date: 30.08.2024, 11:00 AM 10 02:00 PM						
	Loan Code/ Branch/ Borrower(s)/Co- Borrower(s)/ Guarantor(s)	Demand Notice Date and Amount	Property Address _final		Earnest Money Deposit (EMD) (10% of RP)		
(R Pr (B 2. Th 3. Sh 4.	pan Code No. 00002840)/ ajkot Branch) 1. Sanya operty Private Limited. orrower/Mortgagor) Mr. Anil Bhagwandas aakker (Guarantor/mortgagor) Mrs. Amitaben Pravinchandra tah. (Guarantor) Mr. Pravinchandra S. Shah uarantor)	Rs. 7,11,11,625/- (Rupees Seven Crore Eleven Lakh Eleven Thousand Six	Plot of land located at S. No. 63/4 admeasuring 4,755 sq.mt and S. No. 53/l admeasuring 50,082 sq.mt, Mouje Mundra, faluka Mundra, total admeasuring 54837 Sq.mt situated opposite to Aga Khan School, Mundra (Kutch) Gujarat 370410 alogwith the entire present and future structure thereon in the project Parshva Residency" including but not limited to units as more particularly mentioned in Annexure I and sold flats/units/ apartments of which receivables hypothecated to DHFL have been specifically described in Annexure- II hereto.	Rs. 16,01,32,000- (Rupees Sixteen Crores One Lakh Thirty Two Thousand and Paise Zero Only)	Rs. 1,60,13,200/-, (Rupees One Crore Sixty Lakhs Thirteen Thousand Two Hundred and Paise Zero Only)	(Rupees Fifty Three Crores Fifteen Lakhs Fifty Three	

Bids for entire building will be entertained over individual bids of single property.

The sale "is as is where is & whatever is there is basis."

DATE OF E-AUCTION: 30.08.2024, FROM 11.00 A.M. TO 02:00 P.M. (WITH UNLIMITED EXTENSION OF 5 MINUTES EACH), LAST DATE OF SUBMISSION OF BID: 29.08.2024, BEFORE 04:00 P.M.

STATUTORY 15 DAYS SALE NOTICE UNDER SARFAESI ACT TO THE BORROWER/GUARANTOR / MORTGAGOR

Sd/- (Authorised Officer) Piramal Capital & Housing Finance Limited

he above mentioned Borrower/Guarantor are hereby noticed to pay the sum as mentioned in section 13(2) notice in full with accrued interest til ate before the date of auction, failing which property will be auctioned/sold and balance dues if any will be recovered with interest and cost from ate : August 10, 2024, Place : Raikot